

બાહેધરી પત્રક

આથી હું નીચે સહી કરનાર શ્રી/શ્રીમતી /કું. જણાવું છું કે, આ કાર્યાલયના તારીખ સાથેના જાવક નંબર હુકમ અનુસાર એડહોક ધોરણે ૧૧.માસના કરારના ધોરણે માસિક ફિક્સ પગારથી મને આપવામાં આવેલ હુકમની તમામ બોલીઓ અને શરતો મેં વાંચી છે અને તે મને માન્ય છે.વધુમાં, આ કરારનો સમયગાળો ૧૧ માસનો અથવા બઢતી / સીધી ભરતી / સ્પર્ધાત્મક પરિક્ષાથી નિયમિત નિમણૂક માટે પસંદગી પામેલ ઉમેદવાર ઉપલબ્ધ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની નિમણૂક છે જે મારા ધ્યાનમાં છે અને તે સાથે હું સંમત છું.

હું જાણું છું કે, મારી નિમણૂક એડહોક (તદ્દન હંગામી)૧૧ માસના કરારના ધોરણે નિયત કરેલ માસિક પગારથી કરવામાં આવેલ છે. તેથી મારી કરાર આધારિત (જે તે જગ્યાનું નામ) તરીકેની ૧૧ માસની નિમણૂકના સમયગાળા દરમિયાન સરકારી કર્મચારીને મળવાપાત્ર હોય તેવા કોઈપણ પ્રકારના લાભો મને મળવાપાત્ર નથી. તે સાથે હું સંમત છું અને કરારના આધાર(જગ્યાનું નામ) તરીકેના નિમણૂકના સમયગાળા દરમિયાન સરકારી કર્મચારીઓને મળવાપાત્ર હોય તેવા કોઈપણ લાભોની હું માંગણી કરીશ નહીં અને ભવિષ્યમાં આ અંગેની નિમણૂક બાબતે હું કોઈપણ જાતની પોલિસ કેસ કે કોર્ટ કચેરીનો આશરો લઈશ નહીં.

વધુમાં, હાલમાં મારી સામે કોઈપણ કોર્ટ કેસ અને પોલિસ કેસ ચાલુ નથી.(જે તે પોલિસ સ્ટેશનનું ચાલ-ચલગતનું પ્રમાણપત્ર સામેલ રાખવું.)ઉપરોક્ત બાહેધરી મારા સ્વહસ્તાક્ષરની છે. જે હું કોઈપણ જાતના દાબ-દબાણ વિના અને સંપૂર્ણ સભાન અવસ્થામાં શુદ્ધ બુદ્ધિથી કરું છું અને તે મને કબુલમંજૂર છે અને મારી સમયની નિમણૂક દરમિયાન જો મારી કામગીરી કે મારું વર્તનવ્યવહાર જે તે નિમણૂક આપનાર સત્તા અધિકારીશ્રીની યોગ્ય નહીં જણાય તો તેઓ મને કોઈપણ પ્રકારની જાણ કે નોટીસ આપ્યા સિવાય મારા કરારીય સેવાનો અંત લાવશે તો તે મને કબુલ મંજૂર રહેશે અને તે બદલનું હૂ આજ રોજ આ બાહેધરી પત્રક રૂ.20.ના સ્ટેમ્પ પેપર પર સ્વ હસ્તાક્ષરે લખી નીચે સહી/જમણા અંગૂઠાની છાપ કરી નિમણૂક અંગેના બાહેધરી પત્રને સુપ્રત કરું છું.

નિમણૂક મેળવનારની સહી

.....સાક્ષી ૧

..... સાક્ષી-૨

સંસ્થાના વડાશ્રીની સહી અને
કચેરીનો રાઉન્ડ સીલ

સ્થળ:-

જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની સહી
અને કચેરીનો રાઉન્ડ સીલ

તારીખ:-